

કોર્ટ ઓફ કમિશનર (વિકલાંગ વ્યક્તિઓ માટેના)

ગુજરાત રાજ્ય

(Deemed Civil Court) વિકલાંગ ધારો (સમાન તકો, અધિકારોનું રક્ષણ અને પૂર્ણ ભાગીદારી) ૧૯૯૫

ભોંયતળિયે બ્લોક નં. ૧૬, જુના સચિવાલય, સેક્ટર-૧૦, ગાંધીનગર- ૩૮૨૦૧૦

કેસ નં. ૫૩૫/૨૦૧૫

ક્રમાંક કમિ/અપગ/૨૦૧૬-૧૭ /

તા. ૧૦/૭/૨૦૧૬

વાદી:-

ગેલાતર મહેન્દ્રભાઈ પ્રવિણભાઈ,
આંખની હોસ્પિટલ સામે,
નાગનાથ સોસાયટી પાછળ,
સાવરકુંડલા, અમેરલી

વિરુદ્ધ

પ્રતિવાદી:-

રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી,
રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી,
ચંદ્રમૌલી સોસાયટી,
સાવરકુંડલા, જિ. અમેરલી

શ્રી ગેલાતર મહેન્દ્રભાઈ પ્રવિણભાઈ એ તા.૧૬/૧૨/૨૦૧૫ ની અરજીથી રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, સાવરકુંડલા એ તેઓને રોજમદાર તરીકે છુટા કરીને પુનઃસ્થાપિત નહીં કરેલ હોવાની ફરિયાદ કરેલ પ્રસ્તુત ફરિયાદ ભારતીય વિકલાંગ ધારો- ૧૯૯૫ ની કલમ- ૬૨ હેઠળ તપાસ કરી કેસ નં. ૫૩૫/૨૦૧૫ તરીકે દાખલ કરવામાં આવેલ છે.

૨. પ્રસ્તુત કેસની સુનાવણી તા.૨૦/૦૧/૨૦૧૬ ના રોજ રાખેલ. સુનાવણીના સમયે અરજદાર હાજર રહેલ છે. પ્રતિવાદી પક્ષે કોઈ હાજર રહેલ નથી.
૩. પુનઃ તા.૨૨/૨/૨૦૧૬ ના રોજ મુદતે પક્ષકાર હાજર રહેલ નથી. પ્રતિવાદી પક્ષે રેન્જફોરેસ્ટ અધિકારીશ્રી આર.જે. મોર હાજર રહેલ અને તેઓએ લેખિત રીમાર્ક્સ રજૂ કરેલ છે તે અંગે વધુ સુનાવણી તા. ૨૮/૬/૨૦૧૬ના રોજ યોજાયેલ મુદતે વાદી અને પ્રતિવાદી પક્ષો હાજર રહેલ છે. વાદી અને પ્રતિવાદી પક્ષો તરફ નીચેની વિગતે રજૂઆત કરવામાં આવેલ છે.

૪. વાદીશ્રી ગેલાતર મહેન્દ્રભાઈ પ્રવિણભાઈએ તા.૧૨/૦૧/૨૦૧૬ના પત્ર સાથે લેખિત અને મૌખિક રજૂઆત કરતાં જણાવેલ કે તેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસ સાવરકુંડલામાં તા. ૧૪/૧૦/૨૦૦૦ થી તા. ૨૯/૧૦/૨૦૧૦ સુધી રોજમદાર તરીકે ફરજો બજાવતાં હતાં. વર્ષ ૨૦૦૫ માં અમારી હાજરી ૨૪૦ દિવસ કરતાં વધારે થયેલ છે. તેઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસ, સાવરકુંડલા ખાતે જાહેર માહિતી અધિકાર હેઠળ મેળવેલ માહિતી મુજબ તેમણે કરેલ કામગીરીના દિવસો નીચે મુજબ છે.

ક્રમ	સમય ગાળો	કામની વિગત	દિવસની સંખ્યા
૧	તા. ૧/૧૨/૨૦૦૫ થી તા. ૩૦/૧૧/૨૦૦૬	વાયલેસ પર સંદેશાની આપ લે	૨૬૦
૨	તા. ૧/૧૨/૨૦૦૬ થી તા. ૩૦/૧૧/૨૦૦૭	વાયલેસ પર સંદેશાની આપ લે	૧૮૦
૩	તા. ૧/૧૨/૨૦૦૭ થી તા. ૩૦/૧૧/૨૦૦૮	વાયલેસ પર સંદેશાની આપ લે	૧૫૬
૪	તા. ૧/૧૨/૨૦૦૮ થી તા. ૩૦/૧૧/૨૦૦૯	વાયલેસ પર સંદેશાની આપ લે	૨૩૨
		કુલ	૮૨૮

૫. શ્રી ગેલાતરે તેમની અરજી સાથે તેમણે કામગીરીની વિગતો દર્શાવવામાં આવેલ છે. શ્રી ગેલાતર રજૂઆત કરેલ છે કે નામાદાર સુપ્રિમકોર્ટના ચુકાદા મુજબ તેઓને કાયમી કરવા માટે જરૂરી લાભ નહીં આપી અન્યાય કરવામાં આવેલ છે.

૬. રેન્જ ફોરેસ્ટ ઓફિસર, સાવરકુંડલા શ્રી આર.જે.મોર રૂબરૂ ઉપસ્થિત થઈ તા.૨૮/૨/૨૦૦૬ના પત્ર સાથે લેખિત જવાબ રજૂ કરેલ છે. જે મુજબ વાદીશ્રી ગેલાતર મહેન્દ્રભાઈ દૈનિક વેતનથી રોજમદાર તરીકે તા.૧/૧૨/૨૦૦૫ થી તા.૩૦/૧૧/૨૦૦૯ સુધી જુદા જુદા સમયે કામગીરી બજાવતાં હતાં જેમાં તેઓના કામગીરીના દિવસો તા.૧/૧૨/ ૨૦૦૫ થી તા.૩૦/૧૧/૨૦૦૫ સુધી ૨૪૦ દિવસથી કામગીરી વધુ થયેલ છે. અન્ય કોઈ વર્ષ ૨૪૦ કરતાં વધારે દિવસ થયેલ નથી. હાલમાં સાવરકુંડલા વાયલેસ ઉપર કોઈ નવા રોજમદાર ફાળવવામાં આવેલ નથી. જુના રોજમદાર છુટા કરી, નવા રોજમદાર કામગીરી પર રાખવા શક્ય નથી. વન અને પર્યાવર વિભાગ ધ્વારા રોજમદાર રાખવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. શ્રી ગેલાતરની વન વિભાગ હસ્તક કોઈ ભરતી નિયમિત કરેલ ન હતી, જેથી છુટા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

૭. ઉપરોક્ત તમામ વિગતો જોતા નીચેના મુદાઓ ધ્યાન પર આવેલ છે. શ્રી ગેલાતર મહેન્દ્રભાઈ પ્રવિણભાઈ રેન્જ ફોરેસ્ટ ઓફિસ, સાંવરકુંડલા ખાતે વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ સુધી રોજમદાર વાયલેસ ઓપરેટર તરીકે કામગીરી કરતાં હતાં.

- તેઓને કોઈ નિમણુંકપત્ર આપવામાં આવેલ નથી.
- શ્રી ગેલાતરને વિકલાંગતાના કારણે સેવામાંથી છુટા કરવામાં આવેલ નથી.
- છુટા થયા પછી ઘણાં લાંબા સમય બાદ તેઓએ કાયમી થવા માટે રજૂઆત કરેલ છે.
- વન અને પર્યાવરણ વિભાગની વખતો-વખતની સુચનાઓ અન્વયે શ્રી ગેલાતરને પુનઃસેવામાં લેવામાં આવેલ નથી.

૮. ઉપરોક્ત તમામ મુદાઓ ધ્યાને લેતાં સ્પષ્ટ માલુમ પડે છે કે પ્રસ્તુત કિસ્સામાં પ્રતિવાદી ધ્વારા નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. વાદીશ્રી ગેલાતરને વિકલાંગતાને કારણે અન્યાય કરવામાં આવેલ હોવાનું જણાતું નથી. જે ધ્યાને લઈ નીચે મુજબનો હુકમ કરુ છું.

હુકમ

શ્રી ગેલાતર મહેન્દ્રભાઈ પ્રવિણભાઈ, તા.૧૬/૧૦/૨૦૧૫ ની ફરીયાદ અરજી ગ્રાહ્ય રાખવામાં આવતી નથી. સદરહુ હુકમ કેસનો નિકાલ કરવામાં આવે છે.

(સંજય નંદન)

કમિશનર

નકલ રવાના:-

- (૧) ગેલાતર મહેન્દ્રભાઈ પ્રવિણભાઈ, આંખની હોસ્પિટલ સામે, નાગનાથ સોસાયટી પાછળ, સાવરકુંડલા, અમેરલી તરફ જાણ સારૂ.
- (૨) રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની કચેરી, ચંદ્રમૌલી સોસાયટી, સાવરકુંડલા, જિ. અમેરલી